



રાજકોટ રાજપથ લી.

(કંપનીઝ એક્ટ હેઠળ સંસ્થાપિત રાજકોટ મહાનગરપાલિકા ની સંપૂર્ણ આનુષંગિક કંપની)

Corporate Identificaiton Nubmer : U93000GJ2012PLC072203

૩ જો માળ, મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાનામવા સર્કલ, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫

Connecting people with buses...



મીનીટસ ઓફ પ્રી-બીડ મીટીંગ

રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરી બસ સર્વિસમાં કન્સેશન કાર્ડ/પીરીયોડીક પાસ પુરા પાડવાના કામે પ્રીબીડ મીટીંગ તા.૦૫/૧૧/૨૦૧૮ના રોજ યોજવામાં આવેલ જે મીટીંગની મીનીટસ:-

રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરી બસ સર્વિસમાં કન્સેશન કાર્ડ/પીરીયોડીક પાસ પુરા પાડવાના કામે પ્રીબીડ નિમિત્તે લગત એજન્સીઓ તરફથી કરવામાં આવેલ રજુઆતો અન્વયે તા.૦૫/૧૧/૨૦૧૮ના રોજ સવારે ૧૨:૦૦ વાગ્યે રાજકોટ રાજપથ લી.ની ઓફિસ, મલ્ટી એક્ટીવીટી સેન્ટર, ત્રીજા માળ ખાતે મીટીંગ યોજવામાં આવેલ. જેમાં નીચે મુજબ રાજકોટ રાજપથ લી.નાં અધિકારીશ્રીઓ તેમજ એજન્સીઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહેલ.

રાજકોટ રાજપથ લી. નાં અધિકારીશ્રીઓ:-

ક્રમ	નામ	હોદ્દો
(૧)	શ્રી આર.આર.રૈયાણી	જનરલ મેનેજર(ઈ.ચા.)
(૨)	શ્રી કે.વાય.ઝાલા	ઈ.ચા. આસી. મેનેજર (આર.એમ.ટી.એસ.)
(૩)	શ્રી નિલય આર. પંડ્યા	ડે. જનરલ મેનેજર (એ & એફ)
(૪)	શ્રી ધર્મેશભાઈ માકડીયા	આસી. મેનેજર (મીકે.)

હાજર રહેલ એજન્સી આઇ થ્રી ફેશ આઇડીયા, રાજકોટના પ્રતિનિધિ:-

ક્રમ	નામ	હોદ્દો/સંસ્થા
(૧)	શ્રી અલ્પેશભાઈ મણવર	પ્રોપરાઈટર- આઇ થ્રી ફેશ આઇડીયા

મીટીંગની શરૂઆતમાં જનરલ મેનેજરશ્રી આર. આર. રૈયાણી દ્વારા હાજર રહેલ પ્રતિનિધિઓને આવકારી અભિવાદન કરેલ અને ટેન્ડર બાબતે અને ટેન્ડરની સમયમર્યાદા વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ આઇ થ્રી ફેશ આઇડીયા, રાજકોટને પ્રશ્નો રજુ કરવા જણાવેલ જેની વિગતો નીચે મુજબ છે.

ક્રમ	એજન્સી દ્વારા કરવામાં આવેલ રજુઆત	રાજકોટ રાજપથ લી. દ્વારા આપવામાં આવેલ સ્પષ્ટતા/વિગત
૧	હોલોગ્રામ (મોનોગ્રામ નહિ), બારકોડ અથવા QR કોડ અને છુપાયેલી સિક્યુરીટી ફીચર્સ (જેમકે પાનકાર્ડ, ચલણી નોટ વગેરેમાં આપેલ હોઇ એવી)	ગ્રાહ્ય રાખવામાં આવે છે.
૨	પુફ રીડીંગ રાજકોટ રાજપથ લી. ના સ્ટાફ દ્વારા કરવામાં આવે.	એજન્સી દ્વારા ૭(સાત) દિવસમાં પુફ રીડીંગ કરીને રાજકોટ રાજપથ લી.ને રજુ કરવાનું રહેશે તથા રાજકોટ રાજપથ લી. દ્વારા અંતિમ પુફ રીડીંગ કર્યા બાદ ૭(સાત) દિવસમાં પાસ બનાવી રાજકોટ રાજપથ લી., ને તેની સંપૂર્ણ વિગત ટેન્ડર શરત અનુસાર રજુ કરવાની રહેશે.
૩	બીજા ટેન્ડરોમાં ભાવમાં દર વર્ષે અમુક ટકા વધારો કરવામાં આવતો હોય છે. એ પ્રમાણે પ્રતિ કાર્ડ ભાવમાં દર વર્ષે અમુક ટકા વધારો કરવામાં આવશે કે એજ ભાવ રહેશે.	ટેન્ડર શરત અનુસાર

સદરહું મીનીટસને ટેન્ડરનો એક ભાગ ગણવાનો રહેશે. મીટીંગના અંતે અન્ય કોઈ મુદ્દા ન હોય મીટીંગ ૧૨:૩૦ વાગ્યે પૂર્ણ જાહેર કરવામાં આવેલ.

Sd/-

જનરલ મેનેજર
રાજકોટ રાજપથ લી.

જા.નં./આર.આર.એલ./ ૫૩૩

તા.૦૫/૧૧/૨૦૧૮

નકલ સવિનય જાણ અર્થે રવાના:-

(૧) માન.ચેરમેનશ્રી, રાજકોટ રાજપથ લી., કમિશ્નરશ્રીની ઓફીસ, રાજકોટ મહાનગરપાલિકા.

નકલ રવાના:-

(૧) મે. આઇ થ્રી ફેશ આઇડીયા, રાજકોટ.